

# Psa

## Chapter 90

Gujarati Interlinear

Reference: American Standard Version

	תְּפִלָּה	לְמַנְשָׁה	אִישׁ-	הָאֱלֹהִים	אֲדָנָי	מַעֲוֹן	אֲתָהּ	הַיְיֹתָ	לָנוּ	בְּכָר	וְדָר:	1
	પ્રાર્થના	મુસાની	માણસ	ઈશ્વરના	પ્રભુ	આશ્રય	તું	રહ્યા-છે	અમારો	પેઢી-દર	પેઢી	
		<a href="#">H8605</a>	<a href="#">H0376</a>	<a href="#">H0430</a>	<a href="#">H0136</a>	<a href="#">H4583</a>		<a href="#">H1961</a>		<a href="#">H1755</a>	<a href="#">H1755</a>	
	אֲבֹתָם	הָרִים	יְלָדוֹ	וַתַּחֲוִלְלֵהוּ	אֲרָץ	וַתִּבְבֵּל	וַיַּעֲוֹלֵם	עַד-	עוֹלָם	אֲתָהּ	2	
	પહેલાં	પર્વતો	જન્મ્યા	અને-તે-રચી	પૃથ્વી	અને-જગત	અને-અનાદિકાળથી	તે	અનંતકાળ-સુધી	તું		
		<a href="#">H2962</a>	<a href="#">H3205</a>	<a href="#">H2022</a>	<a href="#">H0776</a>	<a href="#">H8398</a>	<a href="#">H5769</a>	<a href="#">H5704</a>	<a href="#">H5769</a>	<a href="#">H5769</a>		
	אֵל:											
	ઈશ્વર-છે											
		<a href="#">H0410</a>										
	תִּשָּׁב	אֲנוּשׁ	עַד-	דָּכָא	וְתֹאמַר	שׁוּבוּ	בְּנֵי-	אָדָם:				3
	તું-ફેરવે-છે	માણસને	પાછા	ધૂળમાં	અને-કહે-છે	પાછા-ફરો	સંતાનો	આદમનાં				
		<a href="#">H7725</a>	<a href="#">H0582</a>	<a href="#">H5704</a>	<a href="#">H0559</a>	<a href="#">H7725</a>		<a href="#">H0120</a>				
	כִּי	אֶלֶף	שָׁנִים	בְּעֵינָיָהּ	כִּי־	אֲחַמּוּל	כִּי	יַעֲבֹר				4
	કારણ-કે	હજાર	વર્ષ	તારી-નજરમાં	છે-જેવાં-દિવસ-કાલના-ઈ	ગઈ-કાલ	જયારે	વીતી-જાય				
		<a href="#">H0505</a>	<a href="#">H8141</a>		<a href="#">H3117</a>	<a href="#">H0865</a>						
	וְאֶשְׁמֹרָהּ	בְּלִילָהּ:										
	અને-રાતના-એક-પહોર	જેવાં-છે										
		<a href="#">H0821</a>										
	וְרַמְתָּם	שָׁנָה	יְהִי	בְּבִקְרָ	כַּחצִיר	יַחֲלֶף:						5
	તું-તેમને-તાણી-જાય-છે	ઊંધ-જેવાં	તેઓ-થાય-છે	સવારે	ઘાસ-જેવાં	બદલાય-છે						
		<a href="#">H2229</a>	<a href="#">H1961</a>	<a href="#">H1242</a>	<a href="#">H2498</a>	<a href="#">H2498</a>						
	בְּבִקְרָ	יִצְיִן	וַחֲלָף	לְעֶרְב	יְמוּלֵל	וַיִּבְשׁ:						6
	સવારે	ખીલે-છે	અને-ઊગે-છે	સાંજ	કરમાય-છે	અને-સુકાય-છે						
		<a href="#">H1242</a>	<a href="#">H2498</a>	<a href="#">H6153</a>	<a href="#">H3001</a>							
	כִּי-	כָּלִינוּ	בְּאֶפְרָ	וַיְבַחֲמָהּ	נִבְהָלָנוּ:							7
	કારણ-કે	અમે-નાશ-પામીએ-છીએ	તારા-કોંધથી	અને-તારા-રોષથી	ગભરાઈ-જઈએ-છીએ							
		<a href="#">H3615</a>	<a href="#">H0639</a>	<a href="#">H2534</a>	<a href="#">H0926</a>							
	שָׁתָן	(שָׁתָה)	עֹנֹתֵינוּ	לְנִגְדָהּ	לְמֹאֵר	פְּנִיָּה:						8
	તે-મૂક્યાં	તે-મૂક્યાં	અમારાં-અપરાધો	તારી-સામે	અમારાં-ગુપ્ત-પાપો	તારા-મુખના						
		<a href="#">H7896</a>	<a href="#">H5771</a>	<a href="#">H5048</a>	<a href="#">H5956</a>	<a href="#">H6440</a>						
	כִּי	כָּל-	יָמֵינוּ	בְּעֵבְרָתָהּ	כָּלִינוּ	כְּמוֹ-	שָׁנֵינוּ					9
	કારણ-કે	બધા	અમારા-દિવસો	તારા-કોપમાં	અમે-પૂરાં-કરીએ-છીએ	અમારાં-વર્ષા	અમારાં-વર્ષા					
		<a href="#">H3605</a>	<a href="#">H3117</a>	<a href="#">H5678</a>	<a href="#">H3615</a>	<a href="#">H8141</a>	<a href="#">H8141</a>					
	יָמֵי-	שָׁנֹתֵינוּ	בָּהֶם	שָׁנָה	וְאָם	וַבְּבוֹרֹת	שָׁמוּנִים	שָׁנָה	וְרָהֲבָם	עָמְלָ	10	
	દિવસો	અમારાં-વર્ષાના	તેમાં	વર્ષ-છે	અને-જો	બળથી	અંશી	વર્ષ	તોપણ-તેમનું-ગર્વ	શ્રમ		
		<a href="#">H3117</a>	<a href="#">H8141</a>	<a href="#">H8141</a>	<a href="#">H7657</a>	<a href="#">H1369</a>	<a href="#">H8084</a>	<a href="#">H8141</a>	<a href="#">H7296</a>	<a href="#">H5999</a>		
	וְאָנוּ	כִּי-	נָז	חִישׁ	וַנְּעַפָּה:							
	અને-દુ:ખ-છે	કારણ-કે	જલદી-કપાય-છે	ઝડપથી	અને-અમે-ઊડી-જઈએ-છીએ							
			<a href="#">H1468</a>	<a href="#">H2440</a>								

										11	
			עֲבָרָתָךְ : तारो-रीष	רְכִירָאָתָךְ अने-तारा-ભયને-યોગ્ય	אָפֶקֶת तारा-क्रोधनुं	עוֹ सामर्थ	יִוָדַע જાણે-છે	מִי- કોણ			
			<a href="#">H5678</a>	<a href="#">H3374</a>	<a href="#">H0639</a>	<a href="#">H5797</a>	<a href="#">H3045</a>	<a href="#">H4310</a>			
			חֲכָמָה : ज्ञाननुं	לִבָּב हृदय	אֲנָבָא કે-અમે-પામીએ	הוֹדַע शीभव	כֵּן એ-રીતે	יְמִינוּ अमारा-दिवसो	לְמַנּוֹת गणवा	12	
			<a href="#">H2451</a>	<a href="#">H3824</a>	<a href="#">H0935</a>	<a href="#">H3045</a>		<a href="#">H3117</a>	<a href="#">H4487</a>		
			עֲבָרְיָךְ : सेवकी-पर	עַל- तारा	יְהַנְחֵם अने-दया-कर	מִתֵּי सुधी	עֲד- क्यां	יִהְיֶה હે-ચહોવા	שׁוֹבָה પાછો-આવ	13	
			<a href="#">H5650</a>		<a href="#">H5162</a>	<a href="#">H4970</a>	<a href="#">H5704</a>	<a href="#">H3068</a>	<a href="#">H7725</a>		
	יְמִינוּ : अमारा-दिवसोमां	בְּכָל- બધા		אֲנִשְׁמַחָה अने-आनंद-करीએ	וְנִרְנְנָה કે-અમે-ગાઈએ	חֲסִדָּךְ तारी-कृपाथी	בְּבִקְרָךְ સવારે	שׁוֹבְעֵנוּ તૃપ્ત-કર-અમને		14	
	<a href="#">H3117</a>	<a href="#">H3605</a>		<a href="#">H8055</a>			<a href="#">H1242</a>	<a href="#">H7646</a>			
			רַעְיָךְ : दुःख	רָאִינוּ अमे-જોયું	שָׁנֹת वर्षों-જેટલાં	עֲנִיתָנוּ તે-દુઃખ-આપ્યું	כִּימוֹת दिवसों-જેટલા	שָׁמַחְנוּ आनंदित-कर-अमने		15	
				<a href="#">H7200</a>	<a href="#">H8141</a>		<a href="#">H3117</a>	<a href="#">H8055</a>			
			בְּנִיחָם : संतानो-पर	עַל- तेमनां	יְהַדְרֶךָ अने-तारो-मडिमा	פְּעֻלָּךְ तारु-कार्य	עֲבָרְיָךְ सेवकीने	אֶל- तारा	יִרְאֶה प्रगट-थाय	16	
					<a href="#">H1926</a>	<a href="#">H6467</a>	<a href="#">H5650</a>	<a href="#">H0413</a>	<a href="#">H7200</a>		
	יְמַעֲשֶׂה अने-कार्य	עֲלֵינוּ अमारा-पर	כּוֹנְנָה स्थिर-कर	יְדִינוּ अमारा-छाथीनुं	יְמַעֲשֶׂה अने-कार्य	עֲלֵינוּ अमारा-पर	אֶלְהֵינוּ अमारा-ईश्वरनी	אֲדַנִּי प्रभु	נָעַם कृपा	וַיְהִי अने-छोय	17
	<a href="#">H4639</a>			<a href="#">H3027</a>	<a href="#">H4639</a>		<a href="#">H0430</a>	<a href="#">H0136</a>	<a href="#">H5278</a>	<a href="#">H1961</a>	
								כּוֹנְנָהוּ : स्थिर-कर-ते	יְדִינוּ अमारा-छाथीनुं		
									<a href="#">H3027</a>		